

મારી ઇચ્છાઓ જણાવવી

શું તમે જાણો છો?

જો તમને કંઈક થઈ જાય અને તમે તમારા સ્વાસ્થ્ય કે સંભાળ વિશે નિર્ણયો લઈ ન શકો, દાખલા તરીકે જો તમને ચિત્તભ્રમ (ડિમેન્શિયા)ની તીવ્ર બીમારી થાય અથવા ઓચિંતો હુમલો આવે તો તમારું કુટુંબ તમારા માટે નિર્ણયો લેવાના કાનૂની અધિકારો ધરાવતું નથી.



જો તમે નિર્ણયો લેવાની ક્ષમતા ગુમાવી દો અને તમે આગોતરું આયોજન કર્યું ન હોય તો તમારા ડૉક્ટર નિર્ણય લેશે અને કદાચ તમે ઇચ્છો નહીં તે પ્રકારની સારવાર કે સંભાળ તમને આપવામાં આવી શકે છે.


અગાઉથી આયોજન કેવી રીતે કરશો

તમારી સારવાર માટે અગાઉથી આયોજન કરવાની અને કોઈપણ નિર્ણયો લેવામાં આવે તેના કેન્દ્રમાં તમારી ઇચ્છાઓ અને માન્યતાઓ હોય તેની ખાતરી કરવા માટેની ત્રણ રીતો છે:

1) Advance Statement [એડવાન્સ સ્ટેટમેન્ટ]

(મફત)

એડવાન્સ સ્ટેટમેન્ટથી તમે એવી કોઈપણ બાબતો લખી શકો છો જે તમારા સ્વાસ્થ્ય અને સંભાળ સાથેના સંબંધમાં તમારા માટે અને તમારા ધર્મ માટે અગત્યની હોય. દાખલા તરીકે, તમે તમારી પ્રાર્થનાના રોજિંદા સમય, તમે ખાતા હો અને ન ખાતાં હો તેવો ખોરાક, તમારો પોષાક અથવા તમારી સંભાળ ક્યાં લેવામાં આવે વગેરે જેવી બાબતોનો સમાવેશ કરી શકો છો.



2) Advance Decision to Refuse Treatment [સારવાર નકારવાનો આગોતરો નિર્ણય]

(મફત)

સારવાર નકારવાના આગોતરા નિર્ણયથી તમને જે તબીબી સારવાર મેળવવાની ઇચ્છા ન હોય તેના વિશે તમે લખી શકો છો. દાખલા તરીકે, તમે ઈન્જેક્શન, અમુક દવાઓ અથવા કૃત્રિમ રીતે તમને જીવંત રાખવામાં આવે વગેરે જેવી બાબતો નકારી શકો છો.

3) Lasting Power of Attorney for Health and Welfare [સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે

એટર્નીની અબાધિત સત્તા] (£82 અથવા ઓછી આવકવાળા માટે મફત)

સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે એટર્નીની અબાધિત સત્તાથી તમે તમારી વિશ્વાસપાત્ર વ્યક્તિને તમારા તરફથી નિર્ણયો લેવાની કાનૂની સત્તા આપી શકો છો. આમાં તમારી તબીબી સારવાર, તમારી સંભાળ ક્યાં લેવામાં આવે અને તમારી દિનચર્યા વિશેના નિર્ણયોનો સમાવેશ થઈ શકે છે.



આગોતરું આયોજન કરવાથી એ ખાતરી કરી શકાય છે કે તમારી ઇચ્છાઓ અને માન્યતાઓ વિશે અન્યોને જાણ થાય અને તમે લોકોને જે કહેવા માંગતા હો તે કહી ન શકો તો તેના પર અમલ થઈ શકે.

અમારા વિશે

Compassion in Dying લોકોને આગોતરું આયોજન કરવા માટે જરૂરી મદદ અને માહિતી પૂરા પાડે છે. તમે આ નંબર પર અમારો સંપર્ક કરી શકો છો:

- 0800 999 2434
- info@compassionindying.org.uk